



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૦૪/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૯૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૨૫૧ લીટર દેશી દારૂ, ૦૨ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૧ કાર અને ૦૨ રીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫,૨૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૯૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૪૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વાહન ચોરી :

સમાચાર યાદી નં.૬૯૯/૧૯

ચાંદખેડા : દિવ્યેશ મહેશભાઈ રાવલ (રહે.ન્યુ રણછોડરાયનગર વિભાગ-૧ જગતપુર રોડ જગતપુર) એ તા.૨૦/૪/૧૯ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૦૪/૨૦૧૯ સાંજના ૬/૩૦ વાગ્યાના સુમારે જગતપુર ન્યુ રણછોડરાયનગર વિભાગ-૧ માં આવેલ સાંઇબાબા મંદિર સામે પાર્ક કરેલ પોતાની મારૂતી ઇકો ગાડી નંબર જી.જે-૦૧-આર.એક્સ-૮૪૦૬ કિંમત રૂપિયા ૧,૬૫,૦૦૦/- મતાની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ યાવી થી લોક ખોલી અગર તોડી ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર.પટેલ ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :

સમાચાર યાદી નં.૭૦૦/૧૯

બાપુનગર : સવિતાબહેન W/O બાબુભાઈ ચાવડા (ઉ.વ.૬૦)(રહે.ઈન્દીરા ગરીબનગર, ૧૩૭ બસ સ્ટેન્ડ પાસે બાપુનગર) તા.૦૯/૦૪/૧૯ ના કલાક ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાયમસ ઉપર ગરમ પાણી કરતા હતા દરમ્યાન પ્રાયમસમાં ભડકો થતા, શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તા.૧૯/૦૪/૧૯ રાતના ૧૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૭૦૧/૧૯

અમરાઇવાડી : શ્રીકાંતભાઇ ગંગારામ ટીવટે(ઉ.વ.૬૭)(રહે.આસોપાલવ નગર ભગવતી રોડ હાટકેશ્વર અમરાઇવાડી) એ અગમ્ય કારણસર તા.૨૦/૦૪/૨૦૧૯ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના ઉપરના માળે પંખા સાથે સાડી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ગોમજીભાઇ લાલુભાઇ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.